

**LL.B. Semester - 3 (CBCS) Examination**  
**Oct/Nov - 2025 [As Per Syllabus Year July-2022]**  
**Principles of Taxation Law & GST(Core)**

Time: 03:00 Hours

Marks:100

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

|          |                                                                  |      |
|----------|------------------------------------------------------------------|------|
| પ્રશ્ન-૧ | મકાન મિલકતની આવક ગણતી વખતે કઈ કઈ રકમો બાદ મળે છે-ચર્ચા કરો.      | (૨૦) |
|          | અથવા                                                             |      |
| પ્રશ્ન-૧ | આવકવેરાના કાયદા હેઠળ મૂડી નફાની જોગવાઈઓ વર્ણવો.                  |      |
| પ્રશ્ન-૨ | આવકવેરા અન્વયે જડતી અને જપ્તી ટૂંકમાં વર્ણવો.                    | (૨૦) |
|          | અથવા                                                             |      |
| પ્રશ્ન-૨ | અપીલની જોગવાઈઓની આવકવેરા કાયદા નીચે ચર્ચા કરો.                   |      |
| પ્રશ્ન-૩ | પગારની આવકમાં કઈ-કઈ આવકનો સમાવેશ થાય છે અને બાદ મળે છે?          | (૨૦) |
|          | અથવા                                                             |      |
| પ્રશ્ન-૩ | આવકવેરા ધારા હેઠળ અગાઉથી કરવેરા ભરવાની જવાબદારીની જોગવાઈઓ જણાવો. |      |
| પ્રશ્ન-૪ | GST ના કાયદા હેઠળ “ઉત્પાદક વેરા શાખ” ની જોગવાઈઓ સમજાવો.          | (૨૦) |
|          | અથવા                                                             |      |
| પ્રશ્ન-૪ | માલ અને સેવા કર અધિનિયમ નીચે નોંધણી વિગતવાર સમજાવો.              |      |
| પ્રશ્ન-૫ | સમજાવો (કોઈપણ બે)                                                | (૨૦) |
|          | ૧) ખેતીની આવક                                                    |      |
|          | ૨) GST ના પ્રકારો                                                |      |
|          | ૩) GST માં દંડ અંગેની જોગવાઈઓ                                    |      |
|          | ૪) ઈ-કોમર્સ ઓપરેટર                                               |      |

**ENGLISH VERSION**

|       |                                                                                             |      |
|-------|---------------------------------------------------------------------------------------------|------|
| Que.1 | Explain - the enumerated deductions allowable while calculating income from house property. | (20) |
|       | OR                                                                                          |      |
| Que.1 | Describe the provision of capital gain under the Income Tax Act.                            |      |
| Que.2 | Explain in brief the search and seizure under the Income Tax Act.                           | (20) |
|       | OR                                                                                          |      |
| Que.2 | Discuss the provision of appeal under the Income Tax Act.                                   |      |
| Que.3 | Which income is included and exempt from the income tax on salary?                          | (20) |
|       | OR                                                                                          |      |
| Que.3 | State the provision of paying the advance tax under the Income Tax Act.                     |      |
| Que.4 | Explain the “Input Tax credits” under the provisions of GST.                                | (20) |
|       | OR                                                                                          |      |
| Que.4 | Explain in detail the Registration under the Goods and Services Tax.                        |      |
| Que.5 | Explain: (Any Two)                                                                          | (20) |
|       | 1) Income from agriculture                                                                  |      |
|       | 2) Kinds of GST                                                                             |      |
|       | 3) Provision of penalty in GST                                                              |      |
|       | 4) E-commerce operator                                                                      |      |

\*\*\*\*\*